

In the Name of Allah, the Most Beneficent, the Most Merciful

સલામત રીતે મસ્જિદોને ફરીથી ખોલવાના ૯ પગલાં

યુકે સરકારે સંકેત આપ્યો છે કે ઇંગ્લેન્ડમાં મસ્જિદો ફરીથી ખોલવા ની યથાશીલ શક્યતા યોથી જુલાઇ થી છે, જેમાં વેલ્સ અને સ્કોટલેન્ડની પુષ્ટિ પછી થી થઈ શકે છે.

આ માર્ગદર્શિકા મસ્જિદના નેતાઓ ને કાળજીપૂર્વક યોજના બનાવવામાં અને તેમના સમુદાયોની સલામતી અને સુખાકારી જાળવવા ક્યારે અને કેવી રીતે ફરીથી ખોલવી તે નક્કી કરવામાં સહાય માટે રચાયેલ છે.

પગલું ૧: યોજના ક્યારે અને કેવી રીતે કરવી

ફરીથી ખોલતા પહેલાં, કોવિડ સલામતી અધિકારીની નિમણૂક કરવી, સંપૂર્ણ જોખમનું મૂલ્યાંકન કરવું અને ક્યારે અને કેવી રીતે ખોલવું તે વિશે કાનૂની, તબીબી અને વિદ્વાન સલાહ મેળવવી મહત્વપૂર્ણ છે. ઉતાવળ ન કરો: જો તમારે તૈયારી માટે વધુ સમયની જરૂર હોય, તો તે બરાબર છે!

પગલું ૨ : જગ્યાની યોજના બનાવો

તમારી નવી ક્ષમતાની ગણતરી કરો, ખુલ્લી જગ્યા ને ધ્યાનમાં લો, બિનજરૂરી સુવિધાઓ (વુડુ માટે ની જગ્યા, શૌચાલયો) બંધ કરો, એક-માર્ગ પ્રવેશ અને નિકાસ દ્વારા સ્થાપિત કરો, અને શક્ય હોય તો સફાઈ ની યોજના કરો.

પગલું ૩: ઉપકરણોની યોજના બનાવો

નવી દિસા સુચન, સંપર્ક વિનાના ચુકવણી મશીન અને સફાઈ ઉત્પાદનો મેળવો. તમે ભક્તોને કઈ વસ્તુઓ લાવવાનું કહો તે નક્કી કરો (એટલે કે પ્રાર્થના સાદડીઓ, કુરાન, ચહેરાના માસ્ક વગેરે).

નવી દિસા સુચન, સંપર્ક વિનાના ચુકવણી મશીન અને સફાઈ ઉત્પાદનો મેળવો. તમે ભક્તોને કઈ વસ્તુઓ લાવવાનું કહો તે નક્કી કરો (એટલે કે પ્રાર્થના સાદડીઓ, કુરાન, ચહેરાના માસ્ક વગેરે).

તમારા કર્મચારીઓને અને સ્વયંસેવકોને નવા નિયમો, વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પી.પી.ઇ.) કેવી રીતે વાપરવું, પ્રવેશ પર કોવિડ સ્ક્રિનિંગ, કતાર વ્યવસ્થાપન, સ્થળની સફાઈ અને અન્ય આવશ્યક પગલાં વિશે તાલીમ આપો.

પગલું ૫: સમુદાય તૈયાર કરો

તમારા સ્થાનિક સમુદાયને કોણે ઘરે પ્રાર્થના કરવી જોઈએ, તેમજ જે લોકો મસ્જિદમાં પ્રાર્થના કરી શકે છે તેમના માટે નવા નિયમો શું છે તે વિશે શિક્ષિત કરવાની યોજના બનાવો.

પગલું ૬: પૂર્વ-પ્રાર્થનાની યોજના બનાવો

પ્રી-બુકિંગ સિસ્ટમ, કતાર મેનેજમેન્ટ, પ્રવેશદ્વારને ધ્યાનમાં રાખીને અને ભીડને ઘટાડવા માટે સ્પષ્ટપણે બહાર નીકળો, પ્રવેશદ્વાર પર બેઝિક કોવિડ સ્ક્રીનિંગ હાથ ધરવા અને એક-માર્ગ સિસ્ટમ રાખવી.

પગલું ૭: પ્રાર્થનાની યોજના બનાવો

ખુલવાનો સમય મર્યાદિત કરો, લોકોને ઘરે સુનાહની પ્રાર્થના કરવાની સલાહ આપો, ૨ મીટરના અંતરને ચિહ્નિત કરો, ઉપાસકોની દરેક પંક્તિની વચ્ચેની ખાલી પંક્તિની ખાતરી કરો, ખુતબા / પ્રાર્થનાઓ ટૂંકી કરો અને બહુવિધ / સ્મયમંતરે જમાત રાખો.

પગલું ૮: પ્રાર્થના પછી ની યોજના બનાવો

બહુવિધ / સ્મયમંતરે જમાત માટે, દરેક વચ્ચે ઓછામાં ઓછી ૩૦ મિનિટની અંતર કરો, પૂજા કરનારાઓને હાથ મિલાવવા નહીં, કોન્ટેસલેસ કાર્ડ મશીન દ્વારા અથવા ઓઓનલાઇન દાન કરો અને આગલી પ્રાર્થના સુધી મકાનને બંધ કરો.

પગલું ૯ સમસ્યાઓ માટેની યોજના

જો કોઈ પૂજા કરનારને કોવિડથી ચેપ લાગવો હોય તો કોઈ યોજના બનાવો, સંપર્ક ટ્રેસિંગ માટે ઉપસ્થિતોની સૂચિ રાખો, ફરિયાદોને કેવી રીતે નિયંત્રિત કરવી, અને મસ્જિદમાં ન આવી શકે તેવા લોકોનું ઓનલાઇન સેવાઓ દ્વારા સમર્થન કેવી રીતે રાખવું.

Download the full 9-step guide at
bit.ly/MosqueReopening

✉ covid@mcb.org.uk

📷 [@muslimcouncil](https://www.instagram.com/muslimcouncil)

📺 [@muslimcouncil](https://www.youtube.com/muslimcouncil)

Training sessions to support you with implementing the above will be starting soon insha'Allah. Please identify your COVID safety officers who should attend the training sessions.

Collated by:

MCB
The Muslim Council of Britain

Help us do more, donate: LaunchGood.com/MCB